

ત્વરિત જાહેરાત માટે

ઉનાળાની ગમ્મતનું ઝાપટું બ્રેમ્પટન ખાતે આવી રહ્યું છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (19 જૂન 2019) – ચાલો તમારો સ્વિમસુટ, પિકનિક બ્લેકેટ અને પાણીની બોટલ હાથવગી રાખો - ઉનાળો આવી ગયો છે અને બ્રેમ્પટનમાં ગમ્મતની મોસમ આવી ગઈ છે!

થોડ જ સમયમાં ઘણી બધી આઉટડોર સવલતો શરૂ થઈ રહી છે. અને આખા ઉનાળામાં પ્રવૃત્તિઓ થવાની છે.

સમર મૂવીઝ અન્ડર ધ સ્ટાર્સ જુલાઈ 5 થી ઓગસ્ટ 30

શહેરમાં ઠેકઠેકાણે આઉટડોર પરિવારો સાથે જોઈ શકે એવા ફિલ્મોના નિશુલ્ક આઉટડોર સ્ક્રીનિંગ્સ થવાના છે માટે તમારા બ્લેકેટ, લૉન ચેર અને નાસ્તાપાણી લાવશો શો પહેલા ગેમ્સ અને પ્રવૃત્તિઓ થશે.

મૂવીના સંપૂર્ણ સમયપત્રક માટે [અહીં](#) ક્લિક કરો.

ઉનાળાના શિબિરો (Summer Camps) | જુલાઈ 3 થી સપ્ટેમ્બર 1

બાળકો અને યુવાનો આખા ઉનાળામાં વિવિધ રે કેમ્પ્સમાં સક્રિય રહીને ઘણું બધું શીખી શકશે. 2019 માટે નવા શિબિરો ઉમેરવામાં આવ્યા છે. વધારાનાં શુલ્ક ભરીને આગળ અને પાછળની કાળજી ઉપલબ્ધ છે અને પસંદગીના સ્થળો પર કેમ્પ લંચ પ્રોગ્રામ ઉપલબ્ધ છે.

ઉનાળાના શિબિરોની સંપૂર્ણ વિગતો [અહીં](#) ઉપલબ્ધ છે.

પ્લે ઈન ધ પાર્ક | જુલાઈ 1 થી ઓગસ્ટ 31

અઠવાડિયાના દિવસોમાં પસંદગીનાં સ્થળો પર સવારે 9.30 થી સવારે 11.30 સુધી 6 થી 13 વર્ષની વયનાં બાળકો સ્થાનિક પાર્કની મુલાકાત લઈ શકે અને આયોજનબદ્ધ રમતો અને રમતગમત સીટી ઓફ બ્રેમ્પટનનાં પ્રોગ્રામ લિડર્સ સાથે મફત રમી શકે છે.

સ્થળોમ યાદી માટે [અહીં](#) ક્લિક કરો.

પ્રોફેસર્સ લેક બીચ અને બોટહાઉસ | રોજ ખુલ્લું જુન 29 થી સપ્ટેમ્બર 3

બ્રેમ્પટનનાં પોતાના 65-એકરનાં ઝરણાથી ભરેલ સરોવર પર બીચ પર આખો દિવસ માણો. નિરિક્ષણ હેઠળનો તરવાનો વિસ્તાર, વોટરસ્લાઈડ અને ભાડાની બોટ ઉપલબ્ધ છે જો આબોહવા અને વાતાવરણ યોગ્ય હોય. અત્યારે જ ભાડાની બોટ ઉપલબ્ધ છે.

પ્રોફેસર્સ લેકની સંપૂર્ણ વિગતો [અહીં](#) ઉપલબ્ધ છે.

ચિંગકુઝી પાર્ક ઉનાળાની સવલતો | રોજ ખુલ્લું જુન 24 થી સપ્ટેમ્બર 3

બ્રમ્પટનના ડેસ્ટિનેશન પાર્કમાં મળી રહે છે ઢગલાબંધ ઉનાળાની ગમ્મતભરી પ્રવૃત્તિઓ જેમાં સામેલ છે પેટિંગ ઝૂ, પોની પર સવારી, મિનિ ગોલ્ફ, પેડલબોટ્સ, ક્રૂઝલ અને ટ્રેઈન રાઈડ, સ્પ્રે પેડ અને રમતગમતનું મેદાન.

ચિંગકુઝી પાર્કની સંપૂર્ણ વિગતો [અહીં](#) ઉપલબ્ધ છે.

એલડોરાડો પાર્ક આઉટડોર પૂલ | રોજ ખુલ્લું જુન 29 થી સપ્ટેમ્બર 3

બ્રમ્પટનના એક માત્ર આઉટડોર પૂલમાં બપોર પસાર કરો જે કુદરતી વનોથી ઘેરાયેલ છે અને જે ક્રેડિટ નદીના કિનારે સ્થિત છે.

એલડોરાડો પાર્કની સંપૂર્ણ વિગતો [અહીં](#) ઉપલબ્ધ છે.

સ્પ્રે પેડ્સ

આખા શહેર ફરતે આવેલા 14 સ્પ્રે પેડ્સ અને છીછરા પૂલ્સ (વેડિંગ પૂલ્સ)માં ટાઢક મેળવો.

સ્પ્રે પેડના સ્થળોની યાદી માટે [અહીં](#) ક્લિક કરો.

આ પૈકી કોઈ પણ ઉણાળાની પ્રવૃત્તિઓ વિશે શુલ્કો, સ્થળો, પ્રોગ્રામની વિગતો અને ચાલવાના સમય સહિત વધુ માહિતી માટે www.brampton.ca/recreation ની મુલાકાત લો અથવા કોઈ પણ રિક્રિએશન સેંટર પરથી સમર ફન બ્રોશરની નકલ મેળવી લો.

ગ્રીન સિટી તરીકે શક્ય હોય ત્યારે અમે નિવાસીઓને બ્રમ્પટન ટ્રાન્ઝિટનો ઉપયોગ કરવાનું આલ્વાન કરીએ છીએ. તમારા સફરનું આયોજન કરવા માટે www.bramptontransit.com ની મુલાકાત લો.

અવતરણ

"બ્રમ્પટનમાં ઉનાળો એટલે રોમાંચથી ભરેલ ઋતુ હોય છે. બ્રમ્પટન સ્વાસ્થ્યપ્રદ અને સુરક્ષિત શહેર છે અને હું રહેવાસીઓને શહેરમાં ઠેકઠેકાણે થનાર આઉટડોર મૂવીઝ જોવા, પ્રોફેસર્સ લેક પર તડકાની હુંફ માણવા, એલડોરાડો પાર્કનાં આઉટડોર પૂલમાં ડાઈવ કરવા આલ્વાન કરું છું અને આપણું શહેર વર્ષનાં આ સમયે જે સવલતો આપે છે તેનો લાભ લેવા પ્રોત્સાહિત કરું છું."

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडात्मक संवाद

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca